

M.A. (PSYCHOLOGY) Semester - 3 (CBCS) Examination
OCT/NOV-2024 (AS PER SYLLABUS YEAR JUNE-2019)
Behavior Modification (Elective-5 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	વર્તન ફેરફાર એટલે શું? તેના પાયાનાં ખ્યાલ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	વર્તન ફેરફારનાં આધારસ્તંભ સમજાવો.	
પ્રશ્ન.૨	પરંપરાગત મૂલ્યાંકન અને વાર્તનીક મૂલ્યાંકન વચ્ચેનો તફાવત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	ઔપચારિક અને અનોપચારિક વર્તન વિશ્લેષણ સમજાવો.	
પ્રશ્ન.૩	ક્રમબદ્ધ અસંવેદનીકરણ વિસ્તારપૂર્વક સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	મોડેલીંગ અને વાર્તનીક પૂર્વતાલીમ ચર્ચો.	
પ્રશ્ન.૪	પ્રબલન એટલે શું? તેના પ્રકાર ચર્ચો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	પ્રબલનનાં ઉપક્રમોની ચર્ચા કરો.	
પ્રશ્ન.૫	કોઈપણ બે ટૂંકનોંધ લખો.	(૧૪)
	1. વિશ્રાંતિની પ્રયુક્તિ 2. વર્તન વિશ્લેષણનાં હેતુ 3. દૃઢાગ્રહ તાલીમ 4. સંભાવ્ય સ્થિતિઓનાં પ્રબંધ	

ENGLISH VERSION

Que.1	What is Behavior Modification? Explain it's basic concepts.	(14)
	OR	
Que.1	Explain the foundations of Behavior Modification.	
Que.2	Explain the difference between Traditional Assessment and Behavioral Assessment.	(14)
	OR	
Que.2	Explain Formal and Informal Behavioral Assessment.	
Que.3	Explain Systematic Desensitization.	(14)
	OR	
Que.3	Discuss the Modelling and Behavior Rehearsal Procedures.	
Que.4	What is Reinforcement? Explain it's types.	(14)
	OR	
Que.4	Discuss schedules of Reinforcement.	
Que.5	Write any TWO short notes.	(14)
	1. Techniques of Relaxation. 2. Purpose of Behavior Assessment. 3. Assertiveness Training 4. Contingency Management	
